

EWS - આર્થિક રીતે નબળા વર્ગના લોકો

પ્રધાનમંત્રી

આવાસ યોજના (શહેરી)

ફોર્મ અને માહિતી પત્રિકા



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

સરદાર પટેલ ભવન, દાશાપીઠ, અમદાવાદ-૧

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

પ્રધાનમંત્રી આવાસ યોજના

આર્થિક રીતે નબળા વર્ગના લોકો (EWS – ECONOMICALLY WEAKER SECTION) માટે આવાસ યોજના

અનુ. નં.	ફેઝ	જગ્યાનું નામ	ફ્લો કરવાના આવાસોની સંખ્યા	માળની વિગત	યોજનાનો કોડ
1	૬	ટી.પી. ૧૦૩ નિકોલ, એફ.પી. ૧૨૦ તથા ટી.પી. ૧૧૯ નિકોલ, એફ.પી.૧૬૪, દિવ્યજીવન લાઇફસ્ટાઇલની બાજુમાં, સરોવર પ્લાઝાની સામે, ગંગોત્રી સર્કલ, નિકોલ, અમદાવાદ	1568	P+14	EWS-52
2	૬	ટી.પી.૯૮, કોતરપુર એફ.પી.૮૧, કોતરપુર-નરોડા, ખોડીયાર માતાના મંદિર સામે, શંકર એસ્ટેટની સામે, એસીક જનરલ હોસ્પિટલની પાછળ, નરોડા-નારોલ રોડ,અમદાવાદ	294	P+7	EWS-55
3	૬	ટી.પી.૯૮, કોતરપુર એફ.પી.૮૦, કોતરપુર-નરોડા, ખોડીયાર માતાના મંદિર સામે, શંકર એસ્ટેટની સામે, એસીક જનરલ હોસ્પિટલની પાછળ, નરોડા-નારોલ રોડ,અમદાવાદ	171	P+9	EWS-56
4	૬	ટી.પી.૨૧, મોટેરા એફ.પી.૩૯૫, મહાકાળીનગરની સામે, પરિમલ હોસ્પિટલના ખાયાંમાં, મોટેરા, અમદાવાદ	56	P+7	EWS-57
5	૬	ટી.પી.૨૧૬, શીલજ એફ.પી.૩, નિસર્ગ ડ્રીમની સામે, શીલજ રીંગરોડ બ્રીજ પાસે, બોપલ તરફ, શીલજ (બોપલ), અમદાવાદ	110	P+10	EWS-58
6	૬	ટી.પી.૨૧૬, શીલજ એફ.પી.૨૫, શીલજ, કાવેરી સોહમ ફ્લેટની પાસે, નિસર્ગ ડ્રીમથી આગળ, શીલજ રીંગરોડ બ્રીજ પાસે, બોપલ તરફ, શીલજ (બોપલ), અમદાવાદ	392	P+7	EWS-59
7	૬	ટી.પી.૧૦૪, ઓઢવ એફ.પી.૪૮, ઓઢવ, ભિક્ષુક ગૃહ રોડ, ભાથીજી મહારાજના મંદિર પાસે, ઓઢવ, અમદાવાદ	540	P+9	EWS-60
8	૬	ટી.પી.૧૧૧, નિકોલ એફ.પી.૧૫૯, કઠવાડા જી.આઇ.ડી.સી. મુખ્ય પ્રવેશદ્વારની બાજુમાં,સરદાર પટેલ રીંગરોડ-નિકોલ ચાર રસ્તા પાસે, ટોરેન્ટ પાવર સ્ટેશનની નજીક, નિકોલ, અમદાવાદ	376	P+13 / P+14	EWS-64
9	૬	ટી.પી.૧૧૧, નિકોલ એફ.પી.૧૮૬, કઠવાડા જી.આઇ.ડી.સી. મુખ્ય પ્રવેશદ્વારની બાજુમાં, સરદાર પટેલ રીંગરોડ-નિકોલ ચાર રસ્તા પાસે, ટોરેન્ટ પાવર સ્ટેશનની નજીક, નિકોલ, અમદાવાદ	666	P+13 / P+14	EWS-65
10	૬	ટી.પી.૪૬, મોટેરા-કોટેશ્વર એફ.પી.૨૩૪, એસ.બી.આઇ. બેંક પાસે, ભાટથી મોટેરા કોટેશ્વર રોડ, મોટેરા-સાબરમતી, અમદાવાદ	1512	P+13	EWS-66
11	૯	ટી.પી. ૮૫ સરખેજ મકરબા ઓકાફ એફ.પી. ૧૨૩, તથા ટી.પી. ૯૨/બી એફ.પી. ૧૫૪ જૈનમ મલ્લિષ્ટ સામે , સરખેજ મકરબા , અમદાવાદ	2140	P+10	EWS-76
		કુલ	7825		



AHMEDABAD MUNICIPAL CORPORATION EWS AFFORDABLE HOUSING SCHEME

EWS 52: TP No. 103, FP No. 120 & TP No. 119, FP No. 164, Opp.
Sarovar Plaza, Gangotri Circle, Nikol, Ahmedabad - 382350




CARPET AREA TABLE

ROOM	CARPET AREA (Sq. Mtr.)
LIVING ROOM	10.96
BEDROOM	8.64
KITCHEN	3.58
BATH	1.52
WC	1.22
WASH AREA	2.06
TOTAL	27.98



AHMEDABAD MUNICIPAL CORPORATION EWS AFFORDABLE HOUSING SCHEME

EWS 52: TP No. 103, FP No. 120 & TP No. 119, FP No. 164, Opp.
Sarovar Plaza, Gangotri Circle, Nikol, Ahmedabad - 382350




Site Location



AHMEDABAD MUNICIPAL CORPORATION EWS AFFORDABLE HOUSING SCHEME

EWS-55: TP No. 98, FP No. 81, Opp. Shankar Estate, B/h ESIC
General Hospital, GIDC Naroda, Ahmedabad - 382330



CARPET AREA TABLE

ROOM	CARPET AREA (Sq. Mtr.)
LIVING ROOM	10.98
BEDROOM	8.58
KITCHEN	3.60
BATH	1.71
WC	1.28
WASH AREA	1.85
TOTAL	28.00



AHMEDABAD MUNICIPAL CORPORATION EWS AFFORDABLE HOUSING SCHEME

EWS-55: TP No. 98, FP No. 81, Opp. Shankar Estate, B/h ESIC
General Hospital, GIDC Naroda, Ahmedabad - 382330





Site Location



AHMEDABAD MUNICIPAL CORPORATION EWS AFFORDABLE HOUSING SCHEME

EWS-56: TP No. 98, FP No. 80, Opp. Shankar Estate, B/h ESIC
General Hospital, GIDC Naroda, Ahmedabad - 382330



CARPET AREA TABLE

ROOM	CARPET AREA (Sq. Mtr.)
LIVING ROOM	10.71
BEDROOM	8.58
KITCHEN	3.58
BATH	1.98
WC	1.29
WASH AREA	1.87
TOTAL	28.01



AHMEDABAD MUNICIPAL CORPORATION EWS AFFORDABLE HOUSING SCHEME

EWS-56: TP No. 98, FP No. 80, Opp. Shankar Estate, B/h ESIC
General Hospital, GIDC Naroda, Ahmedabad - 382330




Site Location



AHMEDABAD MUNICIPAL CORPORATION EWS AFFORDABLE HOUSING SCHEME

EWS-57: TP No. 21, FP No. 395, Opp. Mahakalinagar, Nr. Parimal Hospital, Motera Stadium Rd, Ahmedabad - 380005




CARPET AREA TABLE

ROOM	CARPET AREA (Sq. Mtr.)
LIVING ROOM	10.98
BEDROOM	8.58
KITCHEN	3.60
BATH	1.71
WC	1.28
WASH AREA	1.85
TOTAL	28.00



AHMEDABAD MUNICIPAL CORPORATION EWS AFFORDABLE HOUSING SCHEME

EWS-57: TP No. 21, FP No. 395, Opp. Mahakalinagar, Nr. Parimal Hospital, Motera Stadium Rd, Ahmedabad - 380005





Site Location



AHMEDABAD MUNICIPAL CORPORATION EWS AFFORDABLE HOUSING SCHEME

EWS-58: TP No. 216, FP No. 3, Opp. Nisarg Dreams, Nr. Shilaj Ring
Road Bridge, Bopal, Ahmedabad - 380058




CARPET AREA TABLE

ROOM	CARPET AREA (Sq. Mtr.)
LIVING ROOM	10.71
BEDROOM	8.58
KITCHEN	3.58
BATH	1.98
WC	1.29
WASH AREA	1.87
TOTAL	28.01



AHMEDABAD MUNICIPAL CORPORATION EWS AFFORDABLE HOUSING SCHEME

EWS-58: TP No. 216, FP No. 3, Opp. Nisarg Dreams, Nr. Shilaj Ring Road Bridge, Bopal, Ahmedabad - 380058




Site Location



AHMEDABAD MUNICIPAL CORPORATION EWS AFFORDABLE HOUSING SCHEME

EWS-59: TP No. 216, FP No. 25, Nr. Kaveri Soham Flat, Nr. Shilaj
Ring Road Bridge, Bopal, Ahmedabad - 380058




CARPET AREA TABLE

ROOM	CARPET AREA (Sq. Mtr.)
LIVING ROOM	10.98
BEDROOM	8.58
KITCHEN	3.60
BATH	1.71
WC	1.28
WASH AREA	1.85
TOTAL	28.00



AHMEDABAD MUNICIPAL CORPORATION EWS AFFORDABLE HOUSING SCHEME

EWS-59: TP No. 216, FP No. 25, Nr. Kaveri Soham Flat, Nr. Shilaj
Ring Road Bridge, Bopal, Ahmedabad - 380058




Site Location



AHMEDABAD MUNICIPAL CORPORATION EWS AFFORDABLE HOUSING SCHEME

EWS 60: TP No. 104, FP No. 48, Near Bhikshuk Gruh Road, Near
Bhathiji Maharaj Temple, Odhav, Ahmedabad - 382415



ODHAV UNIT PLAN


CARPET AREA TABLE	
ROOM	CARPET AREA (Sq. Mtr.)
LIVING ROOM	9.50
BEDROOM	9.10
KITCHEN	4.47
BATH	1.26
WC	1.27
WASH AREA	2.50
TOTAL	28.10





AHMEDABAD MUNICIPAL CORPORATION EWS AFFORDABLE HOUSING SCHEME

EWS 60: TP No. 104, FP No. 48, Near Bhikshuk Gruh Road, Near
Bhathiji Maharaj Temple, Odhav, Ahmedabad - 382415




Site Location




AHMEDABAD MUNICIPAL CORPORATION EWS AFFORDABLE HOUSING SCHEME

EWS-64: TP No. 111, FP No. 159, Besides Kathwada GIDC Main Gate, Nr. Torrent Power Sub Station, Nikol, Ahmedabad - 382350



CARPET AREA TABLE

ROOM	CARPET AREA (Sq. Mtr.)
LIVING ROOM	12.61
BEDROOM	7.82
KITCHEN	4.01
BATH	1.26
WC	0.98
WASH AREA	1.34
TOTAL	28.02





AHMEDABAD MUNICIPAL CORPORATION EWS AFFORDABLE HOUSING SCHEME

EWS-64: TP No. 111, FP No. 159, Besides Kathwada GIDC Main Gate, Nr. Torrent Power Sub Station, Nikol, Ahmedabad - 382350



Site Location



AHMEDABAD MUNICIPAL CORPORATION EWS AFFORDABLE HOUSING SCHEME

EWS-65: TP No. 111, FP No. 186, Besides Kathwada GIDC Main Gate, Nr. Torrent Power Sub Station, Nikol, Ahmedabad - 382350



CARPET AREA TABLE

ROOM	CARPET AREA (Sq. Mtr.)
LIVING ROOM	12.61
BEDROOM	7.82
KITCHEN	4.01
BATH	1.26
WC	0.98
WASH AREA	1.34
TOTAL	28.02



AHMEDABAD MUNICIPAL CORPORATION EWS AFFORDABLE HOUSING SCHEME

EWS-65: TP No. 111, FP No. 186, Besides Kathwada GIDC Main Gate, Nr. Torrent Power Sub Station, Nikol, Ahmedabad - 382350





Site Location



AHMEDABAD MUNICIPAL CORPORATION EWS AFFORDABLE HOUSING SCHEME

EWS-66: TP No. 46, FP No. 234, Nr. SBI Motera Koteshvar Road
Branch, Bhat Motera Link Rd, Motera, Ahmedabad - 382424



CARPET AREA TABLE

ROOM	CARPET AREA (Sq. Mtr.)
LIVING ROOM	11.31
BEDROOM	9.37
KITCHEN	3.82
BATH	1.12
WC	1.57
WASH AREA	0.98
TOTAL	28.17



AHMEDABAD MUNICIPAL CORPORATION EWS AFFORDABLE HOUSING SCHEME

EWS-66: TP No. 46, FP No. 234, Nr. SBI Motera Koteshvar Road
Branch, Bhat Motera Link Rd, Motera, Ahmedabad - 382424




Site Location



AHMEDABAD MUNICIPAL CORPORATION EWS AFFORDABLE HOUSING SCHEME

EWS-76 T.P. 85 Sarkhej Makarba Okaf F.P. 123, and T.P. 92/B F.P.
154 Opposite Jainam Mosque, Sarkhej Makarba, Ahmedabad




CARPET AREA TABLE

ROOM	CARPET AREA (Sq. Mtr.)
LIVING ROOM	10.81
BEDROOM	7.20
KITCHEN	4.12
BATH	1.84
WC	0.95
WASH AREA	1.80
PASSAGE	1.33
TOTAL	28.05



AHMEDABAD MUNICIPAL CORPORATION EWS AFFORDABLE HOUSING SCHEME

EWS-76 T.P. 85 Sarkhej Makarba Okaf F.P. 123, and T.P. 92/B F.P.
154 Opposite Jainam Mosque, Sarkhej Makarba, Ahmedabad



Site Location

યોજનાની વિગતો

- (૧) યોજના અંતર્ગત આવાસો અંદાજે ૨૮.૦૦ ચો.મી. કારપેટ એરીયા (૩૩.૪૮ ચો.વાર) અને બિલ્ટઅપ એરીયા ૩૩.૦૦ થી ૩૫.૦૦ ચો.મી. એટલે કે (૩૯.૪૫ થી ૪૧.૮૪ ચો.વાર) ના બાંધકામવાળા થશે. જે અંશતઃ ફેરફારને પાત્ર રહેશે.
- (૨) અંદાજીત ખરેખર થનાર ખર્ચ રૂ. ૬.૦૦ લાખનો થાય તેમ છે. (જમીનની કિંમત વગર) તે મકાનો લાભાર્થીને જમીનની કિંમત વગર તેમજ લાભાર્થીને મળતી તમામ સરકારી (રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની) સહાય બાદ કરીને રૂ.૩.૦૦ લાખમાં ફાળવવામાં આવશે.
- ૩) સદર આવાસની ફાળવણી પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત થયેલ હોઇ તે પૈકી PMAY ના ચાર ઘટક જેવા કે AHP (એફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેક્ટ), BLC (બેનીફિશીયરી લીડ કન્સ્ટ્રક્શન), CLSS (કેડીટ લીન્ક સબ સીડી), ISSR (ઈન સીટુ સ્લામ રીહેબિલીટેશન) માંથી કોઈપણ એક જ ઘટકમાં સહાય મળવા પાત્ર છે. ઉપરોક્ત ચાર ઘટક પૈકી કોઈપણ ઘટકમાં લાભ મેળવેલ ન હોય તે જ ફાળવણીને પાત્ર રહેશે તથા જો એવું માલુમ પડશે કે અરજદારે સુચવેલ લાભ મેળવેલ છે તો સદર ફાળવેલ આવાસની ફાળવણી અ.મ્યુ.કો. દ્વારા રદ કરવામાં આવશે.
- ૪) આ આવાસ (PMAY) અંતર્ગત ફાળવેલ હોઈ સદર આવાસ ઉપર બેંક કે ફાઇનાન્સિયલ સંસ્થા પાસેથી CLSS સહાયનો લાભ મળવા પાત્ર નથી તથા મેળવવાની રહેશે નહીં.
- ૫) મેન્ટેનન્સ ડીપોઝીટ પેમેન્ટ લેતા પહેલા રૂ.૩૦,૦૦૦/- અલગથી ભરવાની રહેશે.
- ૬) પાયાની તમામ સગવડો જેવી કે પાણી પુરવઠો/ગટરલાઇનની સુવિધા પુરી પાડવામાં આવશે. અ.મ્યુ.કોર્પો. દ્વારા પુરી પાડવામાં આવતી સેવાઓ સિવાયની સુવિધા માટેનો ખર્ચ લાભાર્થીએ ભોગવવાના રહેશે.
- ૭) આંગણવાડી/આરોગ્ય કેન્દ્ર/તાલીમ કેન્દ્ર (ઉમ્મીદ) બાળકો માટે ક્રિડાંગણ જેવી સુવિધાઓ માપદંડ મુજબ વધારે આવાસો હોય ત્યાં આપવામાં આવશે.
- ૮) અન્ય કોઈ લીગલ ચાર્જ કે તેનાં આનુષંગિક ખર્ચાઓ લાભાર્થીએ ભરવાના/ભોગવવાનો રહેશે.
- ૯) દર્શાવેલ પ્લાનીંગ અને બાહ્ય દેખાવ સૂચિત છે. જેમાં ટેકનીકલ જરૂરિયાત મુજબ ફેરફાર થવાની શક્યતા છે. જે લાભાર્થીએ માન્ય રાખવાનો રહેશે અને બંધનકર્તા રહેશે. તે અંગે કોઈ વાદવિવાદ કે તકરાર કરી શકાશે નહીં.

અરજીપત્ર રજૂ કરતી વખતે દરેક અરજદારે પોતાના બેંક એકાઉન્ટનો કેન્સલ કરેલ ચેક/બેંક એકાઉન્ટની પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ, રીઝર્વ કેટગરીના અરજદારોએ પોતાની જાતિ અંગેના ગુજરાત રાજ્યના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ તથા વિકલાંગતાનો લાભ ઇચ્છતા અરજદારે (૪૦% કે તેથી વધુ વિકલાંગતા અંગેનું) સીવીલ સર્જનનું પ્રમાણિત સર્ટિફિકેટ ફરજિયાત સામેલ કરવાનું રહેશે. જ્યારે અરજદાર સફળ થાય ત્યાર બાદ અમ.મ્યુ.કોર્પોરેશન જે દસ્તાવેજી પૂરાવા માંગે તે તમામ દસ્તાવેજો અરજદારે ફરજિયાતપણે સમય મર્યાદામાં રજૂ કરવાના રહેશે.

શરતો

- ૧) અરજદારે અરજી ફોર્મ સાથે ડીપોઝીટની રકમ રૂ.૭૫૦૦/- (રૂપીયા સાત હજાર પાંચસો પૂરા) ભરવાના રહેશે.
- ૨) મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા ૨૦% રકમ (અરજી સાથે ભરપાઇ કરેલ ડીપોઝીટ બાદ કરતાં બાકીની રકમ) “ટ્રો”માં સફળ થયા બાદ અમ.મ્યુ.કોર્પોરેશન જણાવે ત્યારે અરજદારે ત્રણ માસમાં અચૂકપણે ભરવાની રહેશે. ત્યારબાદ બાકી રહેતી ૮૦% રકમના એકસરખા દસ(૧૦) હપ્તા (અંદાજે એક વર્ષમાં તમામ ૮૦% રકમ થાય તે રીતે) સમયાંતરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમાં કરાવવાના રહેશે. તે ઉપરાંત છેલ્લા હપ્તા સાથે મેન્ટેનન્સ ડીપોઝીટ તથા

અન્ય ચાર્જીસ પણ ભરપાઇ કરવાના રહેશે. અરજદાર દ્વારા ૨૦% રકમ જે બેંકમાં ભરેલ હોય તે જ બેંકમાં બાકીના ૮૦% રકમ ભરવાની રહેશે.

૩) આવાસ યોજનાનું બાંધકામ પૂર્ણ થયા બાદ મકાનની નક્કી થયેલ પૂરેપૂરી કિંમત ભરપાઇ થયા બાદ જ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થયેથી અરજદારને તેમને ફાળવવામાં આવેલ મકાનનો કબજો સોંપવામાં આવશે.

૪) કુટુંબના તમામ સભ્યોની મળીને કુટુંબની કુલ વાર્ષિક આવક રૂ.૩,૦૦,૦૦૦/- થી વધુ હોવી જોઈએ નહીં. આ યોજના માટે જ્યાં જ્યાં કુટુંબનો ઉલ્લેખ કરાયેલ છે. ત્યાં કુટુંબ એટલે પોતે, પોતાની પત્ની/પતિ, તથા તેમના અપરણીત બાળકો. કુટુંબનો પુખ્ત વયનો સભ્ય ભારત દેશમાં પાકુ મકાન કે જમીનનો પ્લોટ ન ધરાવતો હોય તો તેનો વૈવાહિક દરજ્જો ધ્યાને લીધા વગર PMAY યોજના હેઠળ આવાસ મેળવવા હકદાર છે.

૫) અરજી પત્રક ઉપર ફોટો ફરજિયાત અપલોડ કરવાનો રહેશે.

૬) કેટેગરી અંગેનું પ્રમાણપત્ર અમ.મ્યુનિ.કોર્પોરેશનમાં મંગાવે ત્યારે મૂળ સ્વરૂપે (અસલ) રજૂ કરવાનું રહેશે.

જૂથ	પ્રમાણપત્ર
અનુસૂચિત જાતિ	નિયત થતાં ગુજરાત રાજ્યના સરકારી અધિકારીશ્રી દ્વારા અપાયેલ પ્રમાણપત્ર
અનુસૂચિત જનજાતિ	
સામાજિક અને આર્થિક રીતે પછાત (બક્ષી પંચ)	
અંધજન અપંગ, માનસીક વિકલાંગતાને અગ્રીમતા રહેશે (HORIZONTAL RESERVATION) ૫%	સિવિલ સર્જન દ્વારા અપાયેલ ૪૦% કે તેથી વધુ વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર
<p>નોંધ: વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓના અધિકારો માટેનો અધિનિયમ ૨૦૧૬ મુજબ "વિકલાંગતા ધરાવતી વ્યક્તિ"એટલે કે એવી વ્યક્તિ જેને લાંબા સમયથી શારીરિક, માનસીક, બૌદ્ધિક અને સંવેદનાકીય ક્ષતિ કે ખામી છે જે અવરોધોને પ્રતિક્રિયા આપવામાં અને સમાન રીતે સમાજમાં અન્યો સાથે તેમની પુર્ણ અને અસરકારક ભાગીદારીમાં અવરોધરૂપ બને છે.આવા લાભાર્થીઓનો સમાવેશ અંધજન/અપંગ (૪૦% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા ધરાવતા વ્યક્તિઓ)ની કેટેગરીમાં કરવામાં આવશે.પરંતુ તે અંગે વખતોવખતના સુધારાઓ લાગુ પડશે.</p> <p>આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય આખરી ગણાશે.</p>	

૭) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ,બક્ષીપંચ અને જનરલ કેટેગરીનાં Benchmark Disability ધરાવતા દિવ્યાંગજનોને ૫% Horizontal Reservation આપવામાં આવશે.તે અંગે સક્ષમસત્તાનો નિર્ણય આખરી રહેશે.

૮) આરક્ષણ કેટેગરીમાં સમાવિષ્ટ અરજદારે પોતાની જાતિ અંગેની સાચી વિગત કાળજીપૂર્વક ભરવી. ખોટી કેટેગરી દર્શાવીને અરજી કરનારનું ફોર્મ આપો આપ રદ થયેલું ગણાશે.ખોટી કેટેગરી બતાવીને જે- તે કેટેગરીનો લાભ લેવો તે ફોજદારી ગુનો બને છે.

૯) અરજદાર પતિ-પત્ની અલગ-અલગ જાતિના હોય તેવા કેસમાં જેના નામે અરજી કરવામાં આવેલ હશે તેની જ જાતિ અંગેનો પૂરાવો માન્ય રાખવામાં આવશે.

૧૦) આરક્ષણ કેટેગરીમાં જાતિ આરક્ષણ મેળવવા માટે ગુજરાત રાજ્ય સિવાય બહારના રાજ્યનું જાતિ પ્રમાણપત્ર માન્ય રાખી શકાતું નથી.આવા અરજદારોએ તેમના ગુજરાતમાં થયેલા અધિકૃત વસવાટના સમયગાળાને ધ્યાનમાં લઈ તેઓ તે સમયગાળા મુજબ જાતિ પ્રમાણપત્ર મેળવવાની યોગ્યતા ધરાવતા હોય તો ગુજરાત રાજ્યનાં સંબંધિત સક્ષમ

અધિકારીશ્રીનું પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. તેથી, જો તેવું પ્રમાણપત્ર રજૂ કરવામાં નહીં આવે તો અરજી ફાળવણી રદ કરવામાં આવશે.

- ૧૧) આરક્ષિત કેટેગરીમાં પૂરતી અરજી ન આવે તો તેના કવોટા અન્ય આરક્ષિત કેટેગરીમાં તબદીલ થશે અને તેમાં પણ અરજીઓ ન આવે તો તેવો ખાલી રહેતા કવોટા જનરલ કેટેગરીમાં તબદીલ કરાશે. આ બાબતે અમ.મ્યુનિ. કોર્પોરેશનનો નિર્ણય આખરી ગણાશે.
- ૧૨) મકાનોની ફાળવણી “કોમ્યુટર - ડ્રો”થી કરવામાં આવશે. “ડ્રો”ના અંતે મકાનની ફાળવણી ન થયેલ હોય તેવી અરજીઓ સાથે આપવામાં આવેલ ડીપોઝીટની રકમ અરજદારે સૂચવેલ બેંક ખાતામાં વિના વ્યાજે જમા આપવામાં આવશે.
- ૧૩) લોન અપાવવા અંગેની કોઈ જ જવાબદારી અમ.મ્યુનિ.કોર્પોરેશનની રહેશે નહિં. અત્રેથી એમપેનલ કરવામાં આવનાર બેંકો પાસેથી લોન મેળવતી વખતે ટ્રાઇપાર્ટી એગ્રીમેન્ટ કરવાનો રહેશે. આ સિવાયની બેંકો પાસેથી લોન મેળવવા જરૂરી પુરાવા અમ.મ્યુનિ.કોર્પોરેશન તરફથી અરજદારની માંગણીના અનુસંધાને નિયત ચાર્જ લઈને પૂરા પાડવામાં આવશે. લોનનાં તમામ કેસોમાં લોન મેળવવા માટે થતો તમામ ખર્ચ અરજદારે ભોગવવાનો રહેશે.
- ૧૪) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિમણુંક કરવામાં આવેલ એન.જી.ઓ. મારફતે આ યોજનાનો લાભાર્થીઓ દ્વારા ફરજિયાતપણે એસોસિએશન રચવાનું રહેશે. અ.મ્યુ.કોર્પો.જણાવે ત્યારે સઘળી આંતરિક સુવિધાઓ જેવી કે પાણી પુરવઠો, ગટર, સ્ટ્રીટલાઇટ, રસ્તા, લીફ્ટ વિગેરે સુવિધાઓ તેમના એસોસિએશને સંભાળી લેવાની રહેશે.
- ૧૫) આ યોજનાના લાભાર્થીઓ દ્વારા એસોસિએશનના નામનું બેંકમાં ખાતું ખોલવવાનું રહેશે. અમ.મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મકાનની સાથે વસૂલવામાં આવેલ મેન્ટેનન્સ ડીપોઝીટની રકમ સામાન્ય સુવિધાઓ તબદીલ કરતી વેળાએ જ એસોસિએશનના બેંક ખાતે જમા કરાવવામાં આવશે. જે રકમમાંથી સમગ્ર વસાહતની સામાન્ય સુવિધાઓ મરામત/નિભાવની જરૂરી વ્યવસ્થા જે-તે એસોસિએશન દ્વારા જ કરવાની રહેશે.
- ૧૬) લાભાર્થી દ્વારા ફરજિયાતપણે વહેલી તકે એસોસિએશન રચવાનું રહેશે. બી.યુ. પરમીશન આપ્યા બાદ સામાન્ય સુવિધાઓના મેન્ટેનન્સના નાંણા ભરવાની જવાબદારી લાભાર્થીની રહેશે. યોજનામાં એસોસિએશનની રચના કરવામાં ન આવે ત્યાં સુધી લાભાર્થીએ ભરેલ મેન્ટેનન્સ ડીપોઝીટના નાંણામાંથી અ. મ્યુ. કો. દ્વારા કોમન મેન્ટેનન્સ માટે ચુકવવામાં આવશે. તે અંગે કોઈ વળતર કે વાદવિવાદ કરી શકાશે નહીં. જે સામાન્ય સુવિધાઓ તબદિલ કરતી વેળાએ મેન્ટેનન્સ ડીપોઝીટના નાંણા એસોસિએશનના બેંક ખાતામાં અ. મ્યુ. કો. ચુકવેલ રકમો/નાંણા બાદ કરી બાકી બચતી રકમ/નાંણા જમા કરવામાં આવશે.
- ૧૭) તમામ લાભાર્થીઓએ અનુક્રમ નંબર ૬ અને ૭ માં આધાર કાર્ડની વિગત ભરવી ફરજિયાત રહેશે.
- ૧૮) અમ.મ્યુનિ.કોર્પોરેશન ની જમીન ઉપર ખૂબ જ રાહતદરે આ આવાસ યોજના હાથ ધરવામાં આવેલી હોઇ ફાળવણીના સાત (૭) વર્ષ સુધી પોતાને ફાળવવામાં આવેલ મકાન અન્ય કોઇપણને તબદીલ કરી શકાશે નહિં તથા ભાડે આપી શકાશે નહિં.
- ૧૯) શરત ક્રમાંક ૪ થી વ્યાખ્યાયિત કરેલ કુટુંબના કોઇપણ સભ્યના નામે ભારત દેશમાં કોઇપણ સ્થળે તેમનું મકાન અથવા જમીનનો પ્લોટ હોવો જોઇએ નહીં.આ મુદ્દે જો ખોટી રજૂઆત કરાયેલી હોવાનું ધ્યાનમાં આવશે તો એલોટમેન્ટ રદ કરીને ભરેલ ડીપોઝીટની પૂરેપૂરી રકમ જપ્ત કરવામાં આવશે.
- ૨૦) અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં અરજદારની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ થયેલ હોવી જરૂરી છે. ઉંમર અંગે કોઈ મુદ્દો ઉપસ્થિત થાય ત્યારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો પૂરાવા રૂપે રજૂ કરવાનો રહેશે.

- ૨૧) વ્યક્તિદીઠ એક જ ફોર્મ ભરી શકાશે. ફોર્મમાં પસંદગીના સ્થાન દર્શાવવાની જગ્યાએ જુઓ (ફોર્મનું ખાનું નં.૧૧) આપની પસંદગીની અગ્રિમતા અનુસારના ક્રમ દર્શાવવાના રહેશે. આ પસંદગીવાળી કોઇપણ જગ્યાએ કોઇ પણ માળે આવેલું કોઇ પણ આવાસ ફાળવવામાં આવશે તેને માન્ય રાખવાનું રહેશે.
- ૨૨) ફાળવવામાં આવેલ આવાસોનું લાભાર્થી દ્વારા પત્ની તથા પતિના સંયુક્ત નામે સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટ્રેશન (દસ્તાવેજ) કરાવવાનું રહેશે. જેનો ખર્ચ અરજદારે/લાભાર્થીએ ભોગવવાનો રહેશે.
- ૨૩) સંયુક્ત નામે અરજી કરી શકાશે નહીં.કોઇપણ સંસ્થા/પેઢી/ટ્રસ્ટ/ HUF કે કંપનીના નામે પણ અરજી કરી શકાશે નહીં. વ્યક્તિદીઠ માત્ર ને માત્ર એક જ અરજી કરી શકાશે તથા એક કુટુંબ એક જ આવાસ મેળવવા હકદાર રહેશે.
- ૨૪) અરજદારે પસંદગીના જેટલા સ્થાનોની અગ્રિમતા દર્શાવેલ હશે તેના બદલે અન્ય સ્થાન પર ફાળવણી થયેલ હશે તો તેવા કેસમાં લાભાર્થી દ્વારા ફાળવણી રદ કરવા અરજી કરવામાં આવશે તો ભરેલ પૂરેપૂરાં નાણાં પરત કરવામાં આવશે.
- ૨૫) લાભાર્થીને વેઇટીંગવાળું એલોટમેન્ટ મળેલ હોય તે કેસમાં ફાળવણી કેન્સલ કરાવવા અરજી કરેથી ભરેલ ડીપોઝીટ પૂરેપૂરી પરત મળી શકશે.
- ૨૬) લાભાર્થીનું અવસાન થાય અને જો તેમના વારસદારો મકાન મેળવવા ઇચ્છે તો તેઓના કાયદેસરના (સીધી લીટીના) વારસદારોને ફાળવવામાં આવશે. આવા વારસદારના કેસમાં જે નવું કુટુંબ અસ્તિત્વમાં આવશે તેની આવકની મર્યાદા જળવાતી નહિ હોય તો પૂરેપૂરી રકમ પરત કરવામાં આવશે. ભરેલ ડીપોઝીટ પરત માંગવામાં આવશે તો સીધી લીટીના વારસદારોને ડીપોઝીટ પરત કરવામાં આવશે.
- ૨૭) “ડ્રો”માં સફળ થયેલ અરજદાર જો ઉપરોક્ત ૨૪, ૨૫ અને ૨૬ વાળા કારણો સિવાય ફાળવણી રદ કરવા વિનંતી કરે તો આ ભરેલ ડીપોઝીટની ૫૦% રકમ જપ્ત કરી ૫૦% રકમ રીફંડ મળશે.
- ૨૮) અરજદારે અરજીપત્રકમાં સૂચવેલ કુલ-૭ (સાત) વિકલ્પો પૈકી ૧ (એક) ફોટો દર્શાવતા (પતિ તેમજ પત્નીના આધારકાર્ડની નકલ) અને ૨ (બીજું) રહેઠાણનું સરનામું દર્શાવતા એમ બંને અંગેના પૂરાવા માટેની પ્રમાણિત નકલ આપવી ફરજિયાત છે.
- ૨૯) અરજદારે આવક માટે પગાર સ્લીપ (સરકારી/અર્ધસરકારી), મામલતદારનું પ્રમાણપત્ર, રાજ્ય સરકારનાં અધિકૃત અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે.
- ૩૦) અરજદારે પસંદગીના જે વૈકલ્પિક સ્થાનો માટેની રજુઆત કરી છે તે સ્થાન ઉપર કોઇપણ માળે મકાન ફાળવવામાં આવશે. તે ફાળવાયેલ મકાન સિવાય અન્ય સ્થાને કે માળે ટ્રાન્સફર કરી આપવાની કોઇ માંગણી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
- ૩૧) મકાનનું પઝેશન સોંપી દીધા બાદ આંતરિક તેમજ બાહ્ય દિવાલોમાં તેમજ સ્ટ્રક્ચરમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવાનો રહેશે નહીં.
- ૩૨) આ યોજનામાં સંજોગોવશાત “ડ્રો” થયા પહેલા કે “ડ્રો” થયા બાદ પ્લાનિંગ,લોકેશન,પ્લોટ,ડિઝાઇન, મકાન/ બ્લોક, નંબરમાં ફેરફાર કરવા અથવા તેને મુલતવી રાખવાનો અમ.મ્યુનિ.કોર્પોરેશનને અબાધિત અધિકાર છે અને રહેશે.
- ૩૩) અરજદારે વર્તમાનપત્રમાં દર્શાવેલ વેબસાઇટ પર ફોર્મ ઓનલાઇન ભરી સબમીટ કરવાનું રહેશે. તે સાથે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તથા ફી સુચના મુજબ ભરવાની રહેશે.

- ૩૪) સદર જાહેરાતની વિગત તથા ફોર્મ અમ.મ્યુનિ.કોર્પોરેશનની વેબસાઇટ www.ahmedabadcity.gov.in ઉપર ઉપલબ્ધ રહેશે. આ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૧૯/૦૬/૨૦૨૬ રહેશે. ત્યારબાદ કોઇપણ ઓનલાઇન અરજીપત્રક કે વિનંતી પત્ર સ્વીકારવામાં આવશે નહિ.
- ૩૫) અરજદારે અરજીપત્રકમાં જણાવેલ પ્રથમ ક્રમાંકવાળા મોબાઇલ નંબર ઉપર “ડ્રો” અંગેની જાણકારી એસ.એમ.એસ.થી મોકલવામાં આવશે.
- ૩૬) અરજદાર ડ્રોમાં સફળ થાય તેથી મકાન ફાળવણી અંગે તેનો હક્ક થતો નથી પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ અંગેના નિયમોનુસાર અધિકૃત હશે તે અને જરૂરી રકમો આપેલ મુદતમાં ભરેલ હશે તો તેઓની અરજી મકાન ફાળવણી માટે વિચારવામાં આવશે.
- ૩૭) અરજદારે પોતાને લાગુ પડતી કેટેગરી નું જ ફોર્મ ભરવાનું રહેશે. તેની કેટેગરી સિવાયનાં ભરેલ ફોર્મ આપોઆપ રદ થવાને પાત્ર છે.
- ૩૮) અરજદારે કુટુંબના સભ્યોની વિગતમાં જેટલા સભ્યોના નામ હોય તે તમામના આધાર કાર્ડની નકલ ફરજિયાત સામેલ કરવાની રહેશે.
- ૩૯) કોઇપણ યોજનામાં પડેશન આપવાની પ્રક્રિયા ચાલુ થયા બાદ વધુમાં વધુ છ માસ સુધીમાં લાભાર્થી દ્વારા સંપૂર્ણ નાણાં ભરેલ ન હોય તો ફાળવેલ આવાસ રદ થશે.(વેઇટીંગના લાભાર્થીઓને લાગુ પડતું નથી.)
- ૪૦) સદર યોજના અંતર્ગત કોઇ પણ વિસંગતતા ઉપસ્થિત થશે તો તે બાબતે મ્યુનિસિપલ કમિશનરશ્રી અમદાવાદનો નિર્ણય આખરી રહેશે.
- ૪૧) અ.મ્યુ.કો.દ્વારા વખતોવખત દૈનિક વર્તમાન પત્રોમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ જાહેર કરવામાં આવશે.જે મુજબ અંતિમ તારીખ પૂર્ણ થાય પછી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.જેની નોંધ લેવી.
- ૪૨) જે આવાસોની અરજી આવ્યા બાદ પણ જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને આવા આવાસોની જરૂરિયાત હશે તો તેવા આવાસો ડ્રો કરતા સમયે ગણતરી માંથી રદ બાતલ કરવામાં આવશે. જો આમ કરવામાં આવે તો કોઈ અરજદાર સદર બાબતે કોઈ પણ પ્રકારનો વાંધો તકરાર કે કાયદાકીય કાર્યવાહી કરી શકશે નહિ જે વંચાણે લઈ તે મુજબ અરજી કરવી.
- ૪૩) સરકારશ્રી દ્વારા શહેરી જમીન (ટોચ મર્યાદા અને નિયમન અધિનિયમ-૧૯૭૬) હેઠળ સંપ્રાપ્ત કરેલ જમીનમાં શહેરી ગરીબોને ૨૫ ચો.મી.ના પ્લોટ ફાળવવા સામે સુવિધાપૂર્ણ મકાનો ફાળવવા બાબતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા એએચએમ/૧૦૨૦૧૪/એસસીએ-૫૮/થ-૧,તા.૧૪/૦૬/૨૦૧૭ થી ઠરાવ કરવામાં આવેલ છે. આ ઠરાવ અનવ્યે પાત્રતા ધરાવતા યુ.એલ.સી.ના લાભાર્થીઓ દ્વારા સક્ષમ અધિકારી અને નાયબ કલેક્ટર, શહેરી જમીન ટોચ મર્યાદાની કચેરીથી મેળવેલ/મેળવી અગ્રતા પ્રમાણપત્ર સાથે અરજી કરે તો આવાસ ફાળવવામાં માત્ર અગ્રતા આપવામાં આવશે. યોજનાની અન્ય શરતો જેવી કે આવક મર્યાદા, આવાસની કીંમત વગેરે સમાન ધોરણે લાગુ પડશે. આ અન્ય શરતોમાં કોઈ પણ છુટછાટ આપવામાં આવશે નહિ. સદરહુ અરજદારે ઓનલાઇન અરજી કર્યાબાદ અરજી ફોર્મ તથા અગ્રતા પ્રમાણપત્રની નકલ એસ્ટેટ હાઉસીંગ સેલ, ત્રીજો માળ, કોર્મશીયલ કોમ્પ્લેક્સ, આરોગ્ય ભવનની બાજુમાં, એસ.ટી.બસ સ્ટેન્ડ સામે, ગીતા મંદીર, અમદાવાદ ખાતે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખથી દિન-૧૦માં (રજાના દિવસો સિવાય) ઓફિસ સમય દરમિયાન રૂબરૂમાં જમાં કરાવવાની રહેશે. (શહેરી ગરીબોને ૨૫ ચો.મી.ના ફાળવેલ પ્લોટની સામે સુવિધા પૂર્ણ મકાન ફાળવવા માટે અગ્રતા આપવામાં આવશે. જેથી શહેરી જમીન ટોચ મર્યાદાની

કચેરીની અગ્રતા પ્રમાણપત્ર મેળવેલ અરજદારો એ જ રૂબરૂ અરજીફોર્મ જમા કરાવવાનું રહેશે. તે સિવાયના અરજદારોએ અરજી ફોર્મ રૂબરૂમાં જમા કરાવવાનું રહેશે નહીં. જેની ખાસ નોંધ લેવી.)

૪૪) લાભાર્થીને મકાનનું પઝેશન સોંપી દીધા બાદ, મહત્તમ ૬ (છ) માસમાં વપરાશ શરૂ કરવાનો રહેશે તથા વપરાશ શરૂ કરવામાં વિલંબ બાબતે આગોતરી જાણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવાની રહેશે. જે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.

૪૫) લાભાર્થીને સોંપણી કરેલ આવાસનો વપરાશ અન્ય ત્રાહિત વ્યક્તિને આપેલ હોવાનું સ્થળ તપાસ દરમ્યાન માલુમ પડશે તો સ્થળે પંચનામું કરી તાત્કાલિક ધોરણે આવાસનો વપરાશ અટકાવી શકશે અને પઝેશન પરત મેળવવાની કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. જે લાભાર્થી અને તેના કુટુંબના સભ્યોને બંધનકર્તા રહેશે.

૪૬) ઉપરોક્ત શરતોનો ભંગ થાય તે સંજોગોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો કોઈ વાંધો, તકરાર કે કાયદાકીય કાર્યવાહી કરી શકશે નહીં.



યોજનાની મુખ્ય વિશેષતાઓ

- ❖ આકર્ષક એલીવેશન
- ❖ ભૂકંપ પ્રતિરોધક બાંધકામ
- ❖ ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટથી બાંધકામ
- ❖ વિદ્વિજ્ઞાણ ટાઇલ્સ ફ્લોરીંગ
- ❖ સેન્ડવિચ કોટાસ્ટોનનું કીચન પ્લેટફોર્મ
- ❖ પાવડર કોટેડ એલ્યુમીનીયમ ગ્લાસ સ્લાઇડીંગ વિન્ડોઝ
- ❖ મુખ્ય દરવાજો, બંને સાઇડ લેમીનેટ સીટનો ફ્લશ ડોર
- ❖ કેમ્પસમાં આર.સી.સી. રસ્તા
- ❖ પાર્કિંગમાં તેમજ તમામ જરૂરી જગ્યાએ પેવર બ્લોકનું પેવીંગ
- ❖ નિયમ મુજબ સ્ટાન્ડર્ડ કંપનીની લીફ્ટની સગવડ
- ❖ પરકોલેટિંગ વેલ



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ - ૧